

Seat No. : _____

DE-117

December-2021

B.A., Sem.-III

**CC-203 : Geography
(Cartographic Method)**

Time : 2 Hours]

[Max. Marks : 25

નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

1. નકશાવિજ્ઞાનનું વિષયવસ્તુ અને વિષયવ્યાપ ટૂંકમાં જણાવો. 5
અથવા
નકશો એટલે શું ? નકશાઓનું વર્ગીકરણ કરો.
2. નકશાનું પ્રમાણ માપ એટલે શું ? પ્રમાણ માપની કોઈ એક પદ્ધતિનો પરિચય આપો. 5
3. નકશાનું વિસ્તૃતીકરણ એટલે શું ? તે શા માટે કરવામાં આવે છે ? 5
અથવા
નકશાનું આકુંચન એટલે શું ? તે શા માટે કરવામાં આવે છે ?
4. પાઈ-ડાયાગ્રામ અથવા સ્તંભ-આલેખો પર નોંધ લખો. 10

Seat No. : _____

DE-117
December-2021
B.A., Sem.-III
CC-203 : Geography
(Cartographic Method)

Time : 2 Hours]

[Max. Marks : 25

Answer the following questions :

1. Write in brief about nature and scope of Cartography. **5**

OR

What is a Map ? Give a classification of Maps.

2. What is a Map Scale ? Explain any one method of representing map scale. **5**

3. What is enlargement of map ? What is its purpose ? **5**

OR

What is reduction of map ? What is its purpose ?

4. Write a note on Pie-diagram. **OR** Bar-graphs. **10**
